

Axel Polymers Limited

Regd. Office & Works: 309, Mokshi, Sankarda-Savli Road, Tal. Savli, Dist. Vadodara - 391780, India. • Telefax: +91-2667-244395, 244438 info@axelindia.com • www.axelindia.com • CIN: L 25200GJ1992PLC017678

04.11.2020

To, BSE Ltd. 25th Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort Mumbai – 400 001

Dear Sir,

Sub: Newspaper Publication of Notice of Board Meeting.

Ref: Intimation under Regulation 47(1) (a) of SEBI (LODR) Regulations, 2015.

Dear Sir,

Pursuant to Regulation 30 of SEBI (LODR) Regulations, 2015, attached please find the cuttings of the advertisement of Notice of Board Meeting published as per Regulation 47(1)(a) of SEBI (LODR), Regulations 2015 in the "Business Standard" English Newspaper - Ahmedabad Edition and "Loksatta Jansatta" Gujarati Newspaper - Vadodara Edition on 04.11.2020, with respect to the Board Meeting scheduled to be held on 11.11.2020.

Kindly take the same in your record

Thanking you,

For Axel Polymers Limited

Jigardan Gadhvi Company Secretary

Encl.

1. Business Standard - Page No. 14 dated 04.11.2020

MOKSHI

2. Loksatta - Jansatta - Page No. 09 dated 04.11.2020

INDUSTRIES LIMITED CIN: L17100DN1985PLC005561 Registered Office: Plot No. 63-B, Danudyog Sahakari Sangh Ltd, Village

Piparia, Silvassa 396 230, Dadra & Nagar Haveli Email Id: bluechiptex@gmail.com Tel. No.: 91-9924422247/91-22-4353 0400 NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 read with regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of the Board of Directors of the Company will be held through video conferencing on Thursday 12th November, 2020 at 3.00 p.m., to consider and approve the Un-Audited Financia Results for the quarter and half year ended 30th September, 2020 with limited review report thereor by the Statutory Auditors of the

Company.

By order of the Board For Blue Chip Tex Industries Limited Bhumit .M. Dharod Company Secretary &

Compliance Office

Mem no.: ACS 51555 Place: Mumbai Date: 3rd November, 2020 For more information please visit www.bseindia.com

TOWA SOKKI LIMITED

NOTICE

Notice, under Regulation 29(1)(a) and 47(1

Tuesday, 10th November, 2020 at 11.00 a.m. at the Registered Office of the Company, inter alia, to consider and approve the Unaudited Financial Results for the quarter and six months ended 30° September, 2020.

This information contained in this notice is also available on the website of the Company

ie. www.towasokki.in and website of the Stock Exchange ie. www.bseindia.com

AMBITION MICA LIMITED

Shop No. 28, 1st Floor, Vitthal Plaza, Opp. Naroda GEB, Off. Dehgam Road

Nava Naroda, Ahmedabad-382330

Phone: 079-29292629 Website:

www.ambitionmica.com,

Email: investor@ambitionmica.com,

CIN: L25202GJ2010PLC059931

NOTICE NOTICE is hereby given that the Meeting of the Board of Directors of the company i

scheduled to be held on Wednesday

November 11, 2020, at 03:00 P.M. at th

registered office of the company. The

Agenda of the business to be transacted a

the Meeting is per the details mentione

To Consider and approve the Un-audited (standalone) financial results for the

ease visit the website of the compar

e www.amhitionmica.com.and.websit

of the Stock Exchanges i.e

www.bseindia.com for further details.

Date: November 03, 2020 Chairman an

Place: Ahmedabad Managing Directo

For, Ambition Mica Limite

Govindbhai V. Pate

quarter and half-year ended on 30ti

hereunder.

September, 2020.

Date : 03-11-2020 Place : Vadodara

Asian Petroproducts and Exports Limited Regd. Office: Tundav Rania Road, Nr. Village Anjesar, Tal: Savli, Dist: Vadodara, Website: www.asianpetro.org, Email: barodagroup99@gmail.com. CIN: L23209GJ1991PLC016666

Regd. Office: : FF-6, Amrapali Apartment, Nr. Air Force Station, Makarpura, Vadodara-390014. Tel/Fax: 0265-2652851, Email: towasurvey@yahoo.co.i CIN: L51909G.11993PLC019111, Website: www.towasokki.

By Order of the

Board of Directors For Towa Sokki Limited

Sd/- Avni Chouhan Company Sercretary

NOTICE

Pursuant to Regulation 29 read with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Wednesday, 11th November, 2020 to consider and approve the Unaudited Quarterly Results of the Company for the Second Quarter and Half Year ended on 30th September, 2020. Notice, under Regulation 29(1)(a) and 47(1) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, is hereby given that a meeting of the Board of Directors of the TOWA SOKKI LIMITED will be held on The said Notice may be accessed on the website of the Company at www.asianpetro.org and may also be accessed on the stock exchange website at www.bseindia.con

> Place: Vadodara Date: 03.11.2020

For Asian Petroproducts and Exports Limited Aniali Gurnan Company Secretary-cum-Compliance Officer

3

PRIME FOCUS LIMITED

Registered Office: Prime Focus House, Linking Road, Opp. Citi Bank, Khar (West), Mumbal - 400 052 • Phone: 022 - 6715 5000 • Par: 022 - 6715 5001 • Website: www.primedrous.com = Famil Id. Linking@primefocus.com = CiN: L92100MH1997PLC108981

NOTICE Notice is hereby given in terms of Regulation 29, 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 Meeting of the Board of Directors of the Company s scheduled to be held on Wednesday, November 11, 2020, inter-alia to consider, approve and ake on record Un-Audited Financial Results (Standalone & Consolidated) of the Company for the ascond quarter and half year ended September 30, 2020.

Further, as per the Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulation, 2015 the Trading Window for dealing in securities of the Company shall remain closed till 48 hours after the declaration of unaudited financial results for the second quarter and half year ended

September 30, 2020.
The notice is also available on the website of the Company www.primefocus.com and that of BSE Limited www.bseindia.com and National Stock Exchange of India Limited www.nseindia.com.

Place : Mumbai Date : November 3, 2020 Parina Shah Company Secretary & Compliance Officer

to stop stem BOI-

Ellora Park Branch : Bank of India Building, Subhanoura - Vadodara - 390023. Tel No. : 0265 - 2398886, 2397341 E-mail: Ellorapark.vadodara@bankofindia.co.in

POSSESSION NOTICE (For immovable property)

The Authorised Officer of the Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 01.06.2019 calling upon the borrower Shri Subash Punjabhai Rajput & Shri Pravinsinh Subhashbhai Rajput to repay the amount mentioned in the notices aggregating Rs. 19,56,820.00 (Rupees Nineteen Lac Fifty Six Thousand Eight Hundred Twenty only) (contractual dues up to the date of Notice) with further interest thereon as mentioned in the notice, and all costs, charges and expenses incurred by the Bank till epayment within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **Symbolic** ssession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 Act read with rule 8 of the Security nterest Enforcement Rules 2002 on this 29th day of October of the year 2020.

The borrower in particular and the public in general is hereby cautioned not to dea with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India for an amount of Rs. 19,55,820.00 (Rupees Nineteen Lac Fifty Six Thousand Eight Hundred Twenty only) (contractual dues up to the date of Notice) with further interest thereon as mentioned in the notice, and all costs charges and expenses incurred by the Bank till repayment.

The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY All that part and parcel of the property owned Shri Subash Punjabhai Rajput & Shri Pravinsinh Subhashbhai Rajput, being A 121, Shivam Residency, Near Akshar Vintage, Dhanyavi Bye pass Road, Tarsali, Vadodara. Registered Sale Deed bearing No. 3924 Dt. 21.06.2016 measuring 100.54 Sq. Mtrs. and undivided common area 46.04 Sq. Mtrs. Total Area 146.58 Sq. Mtrs. and bounded as :- By East : Plot No. A/122, By West : Plot No. A/120, By North : 18.00 Meter Road, By South : Plot No.

Date : 29.10.2020, Place : Vadodara

Authorised Officer, Bank of India

Brijlaxmi Leasing and Finance Limited

Regd. Office: 102A, Sterling Center, R C Dutt Road, Alkapuri, Vadodara, Gujarat 390 007 Website: www.brijlaxmi.com, Email: barodagroup99@gmail.com. CIN: L65993GJ1990PLC014183

NOTICE

Pursuant to Regulation 29 read with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Wednesday, 11th November, 2020 to inter alia consider and approve the Unaudited Quarterly Results of the Company for the Second Quarter and Half Year ended on 30th September, 2020. The said Notice may be accessed on the website of the Company at www.brijlaxmi.com

and may also be accessed on the stock exchange website at www.bseindia.com. For Brijlaxmi Leasing and Finance Limited

Date: 03.11.2020

Sd/-Mansi Gandhi Company Secretary and Compliance Officer

(作) IDBI BANK CIN: L65190MH2004G0I148838

IDBI BANK LIMITED, Retail Asset Center: 2nd Floor, Garg Plaza, 46/A, Gautam Nagar, Nr. MGVCL Office, Race Course Road, Vadodara, Gujarat, Pin - 390007. Phone Number: 0265 - 2325981.

PUBLIC NOTICE FOR SALE OF SECURED ASSETS THROUGH 6-AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTIES UNDER SARFAESH ACT 2002 APPENDIX IV-A [SEE PROVISO TO RULE 8 (6) & 9 (1)]

e-Action Sale Notice for Sale of Immovable Assets the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provise to Rule 8(6), 8.9 (1) of the Security Interest (Enforcement) Rule, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrowers and Guarantors that the below described immovable property mortgaged / charged to IDBI Bank Ltd., the Symbolic Possession of which has been taken by the Authorised Officer of IDBI Bank Ltd., Secured Creditor, will be sold on "As is where is", "As is what is", "Whatever there is", and

	"Without Recourse Basis"			
Sr. No.	Name of Borrower-Co. Borrower/Guarantors/ Mortgagors, Demand Notice Details/ Date of Possession & Date of NPA	Description of Assets	Reserve Price (In Rs.)	EMD (In Rs.)
1.	Shri Manish Nandkishor Gupta & Shri Mandkishor Bhegwandas Gupta Address : Flat No 103, 1st Floor, Rama Shree Residency, B/h. Panchmukhi Temple, Motnath Mahadev Road, Hami-DPS Road, Vadodara - 390016. Date of NPA: 08.08.2019 Demand Notice u/s. 13(2) dated 14.10,2019 of Rs. 29,15,375/- with further interest from 10.10.2019 as mentioned in the notice and incidental expenses, costs thereon Date of Symbolic Possession: 27.12.2019	All that piece and parcel of land comprised in and forming part property situated at Registration Dist. Baroda Sub Dist. Baroda, Ping & being in Mouje Harni, Bearing R S No-239, ward 2, Final Plot No-70/2 of vide T P scheme No-2 (Hami), in which scheme of 10 sub plots is done and out of which sub plot No-7,8 & 3 edmeasuring about 999 sq mt is owned by the first part. In these sub plot No-7,8 & 9 scheme of flats, is going on as per the Raja Chithi Noward 2-L 145 dtd 17.11.2009 with the title "Rama Shree Residency" out if which FSI of Flat No-103 on the first floor along with undivided portion of stair, common passage, parking etc in village Hami, Taluka and District Vadodara. Boundaries are as: East: Flat No.102, West. Open Terrace then OTS, North: OTS, South: Flat No.102.	36,50,000/-	3,65,000/-
2.	Shri Paresh Tulsidas Parekh Address: Flat No. 502, 5th Floor, "ALTON ENCLAVE" Nr. Navrachna International School, Vasna Bhaily Road, Bhayli, Vadodara-390015. Date of NPA: 09.07.2019 Demand Notice u/s. 13(2) dated 24.09.2019 of Rs. 95,16,940.07/- with further interest from 10.09.2019 as mentioned in the notice and incidental expenses, costs thereon. Date of Symbolic Possession: 27.12.2019	All that piece and parcel of land comprised in and forming part of Flat No 502, 5th Floor, scheme named "AITON", Village Bhayali Vadodara 390 020 admeasuring about plot area 78.0 Sqr. Mtrs. along with adjoin open terrace of 65.00 Sqr. Mtrs. situated on land bearing Revenue Survey No 52 being block no 46 of Final Plot No 36 of T.P.Scheme No 2 in the registration in the village Moje: Bhayali, Vadodarain the State of Gujerat Boundaries are as: East: Common Passage and Dadar, West: Margin Land, North: Margin Land, South: Flet No 501	52,00,000/-	5,20,000/-
3.	Shri Paresh Tulsidas Parekh Address: Flat No. 504, 5th Floor, "ALTON ENCLAVE" Nr. Navrachna International School, Vasna Bhaily Road, Bhayli, Vadodara-390015. Date of NPA: 09.07.2019 Demand Notice u/s. 13(2) dated 24.09.2019 of Rs. 95,16,940.07/- with further interest from 10.09.2019 as mentioned in the notice and incidental expenses, costs thereon. Date of Symbolic Possession: 27.12.2019	All that piece and parcel of land comprised in and forming part of Flat No 504, 5th Floor, scheme named "AITON", Village - Bhayali Vadodara 390 020 admeasuring about plot area 78.90 Sqr. Mtrs. along with adjoin open terrace of 65.00 Sqr. Mtrs. situated on land bearing Revenue Survey No 25 being block of 66 of Final Plot No 36 of T.P.Scheme No 2 in the registration in the village Moje: Bhayali, Vadodarain the State of Gujarat Boundaries are as: East: Margin Land, West: Common Passage and Dadar, North: Flat No 503, South: Margin Land.	52,00,000/-	5,20,000/-
4.	Shri Manish Gopalbhai Patel Address: Plot No-C/13, Shivam Duplex, Nr. Suncity, Opp. Ambe Vidhyalaya, Manjalpur, Vadodara-390 010. Date of NPA: 09.07.21(2) dated 24.09.2019 of Rs. 86,24,867.65/- with further interest from 10.09.2019 as mentioned in the notice and incidental expenses, costs thereon. Date of Symbolic Possession: 02.01.2020	All that piece and parcel in respect of immovable property situate at of Piot No. C/13, "Shivam", Nr. Sun City, Manjalpur, Vadodara 390 010 admeasuring about Piot area 156.88 Sqr. Mtrs. and built up area 164.96 Sqr. Mtrs. situated on land bearing Revenue Survey No 314,316,317,318,328,357,358 in the Village Moje: Vadosr, Vadodara the State of Gujarat Boundaries are as: East: 7.5 Mtrs. Society Road, West: Piot No C-20, North: Piot No C-14, South: R.S. No 339	1,07,00,000/-	10,70,000/
5.	Smt. Jinal Manharbhai Rathod & Shri Manharbhai Narandas Rathod Address: Flat No. 402, Bansidhar Complex, Beside - Ashirwad Hospital, Opp- Polo Ground, Vadodara-390001. Date of NPA: 09.07.2018 Demand Notice u/s. 13(2) dated 03.12.2018 of Rs.18,35,418.35/4. with further interest from 10.09.2018 as mentioned in the notice and incidental expenses, costs thereon Date of Symbolic Possession: 23.07.2019	All that piece and parcel in respect of immovable property situate at being a residential Flat No.402 on the 4th Floor, admeasuring 1030 Sq. fis in a scheme named "Bansidhar Complex" constructed on a land lying being and situate at village Vadodara Kasaba sim in Babajipura Vibhag comprised in Vibhag-B ward No-1, Tikka No.18/3 and corresponding city survey No.39/4/A/3 admeasuring 7928.25 Sq. ft. in the registration district Vadodara in the state of Gujarat Boundaries are as: East: Flat No.403, West: Flat No.401, North: Common Passege, South: Bagikhane to Jeyrantna Road	27,81,000/-	2,78,100/-

l	Sale of Bid / Tender Document :	04 Nov., 2020 to 03 Dec., 2020
l	Date of Inspection:	18 Nov., 2020 from 11.00 AM to 4:00 PM
l	Last Date of submission of Bid along with EMD :	03 Dec., 2020 up to 4:00 PM
l	Date of e-Auction / Time of e-Auction :	04 Dec., 2020 at 11:00 AM to 1:00 PM
l	Bid Increase AmountBy :	By Rs. 50,000/-
1. Particulars specified in the schedule above have been stated to the best of the information. Authorized officer / Bank. Authorized officer and		

IMPORTANT DATES

will not be answerable for any error, miss-statement or omission in this public notice For detailed procedure, terms and conditions of the auction process, intending bidders may arrange to obtain Bid/Tender Document from Manage IDBI Bank Ltd., Retail Asset Center, 2nd Floor, Garg Plaza, 46/A, Gautam Nagar, Nr. MGVCL Office, Race Course Road, Vadodara, Gujarat, Pln - 390007 on any working day between 11.00 am to 4.00 pm on payment of non refundable fees of Rs. 100/- (Rupees one hundred only) by a crossed A/c Payee Demand Draft/ Pay order drown in favour of "IDBI Bank Ltd. - A/c Vadodara payable at Vadodara issued by Nationalized Bank/

The Biddrender document can also be downloaded from IDBI website www.idbi.com. Those bidders preferring to download the Bid/ Tend Document shall have to furnish the non refundable fees of Rs. 100/- as at 2 above at the time of submission of the acceptance document with EMD. Interested parties may contact to Shri Apury Jain, (M) 9630468447, Shri Dharmesh Rathod, (M) 9426851581 and Shri Saniay Shah (M) 9913131576. For E-Auction support, please contact: - M/s e-Procurement Technologies Limited - Auction Tiger, B-704, Wall Street-II, Opp. Orient Club, Nr. Gujarat College, Ellis Bridge, Ahmedabad - 380006, Gujarat (India). Bidder Support: 9265562821-079-68136837/80/90 and Shri Chintan

Bhatt, M.: 9978591888, Help Line E-mail ID: gujarat@auctiontiger.net, chintan.bhatt@auctiontiger.net, https://idbi.auctiontiger.net This publication is also "Thirty Days" notice required under Rule 6 (2) of Security Interest (Enforcement) Rules, 2002 to borrower The asset is proposed to being sold is on "As is where is", "As is what is", "Whatever there is", and "Without Recourse Basis". All statutory liabilities The sales will attract provisions of TDS as applicable under Section 194 (1A) Income TaxAct, on culmination of sale depending on sale price.

The sale of movable property will attract CST and the same will be borne by the purchaser.

The successful bidder will be required to deposit 25% of Sale Price (less the amount of EMD) at the time of confirmation of sale. The Balance amou of the sale price is to be paid within 15 days from the date of issue of letter of acceptance by IDBI Bank or such extended period as may be agreed in

s is subject to confirmation by the Bank. If the borrower/guarantor pays the amount due to the Bank in full before date of sale, no sale will b The A.O may permit inter se bidding among the qualified bidders. The AO reserves the right to accept or reject all/any bids without assigning any
reason. In case all the bids are rejected, the AO reserves the right to sell the assets by any of the modes as prescribed in the SARFAESI Act.
 For detailed information and terms and conditions of E-Auction please refer to Bid/Tender Document available.

13. Earnest Money Deposit (EMD) will not carry any interest. The AO may retain EMD of top three bidders up to 3 months from the date of opening of the

14. The Auction shall be subject to detailed terms and conditions as available in the Bid Documents

Authorized Officer, IDBI Bank Limited

Panchmahal Steel Limited
Regd. Office: GIDC Industrial Estate,

ol-389330, Dist. Panchmahals CIN: L27104GJ1972PLC002153. Phone No: 02676-230777, Fax No: 02676-230889 Email: shares@panchmahalsteel.co.in.

Vebsite: www.panchmahalsteel.co.in **NOTICE**

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirement) Regulations, 2015 that a neeting of the Board of Directors of the ompany will be held on Thursday, the 12th day of November, 2020, inter alia, to onsider and approve the Unaudited inancial Results of the Company for the alf year and quarter period ended 30th September, 2020.

he information is also available on the website of the Company www.panchmahalsteel.co.in as also on website of BSE Limited www.bseindia.com.

For PANCHMAHAL STEEL LIMITED

Deepak Nagar GM (Legal) & Date: 03.11.2020 Company Secretary

"Form No. INC-25A" Advertisement to be published in the

newspaper for conversion of public company into a private company Before the Regional Director, Ministry of Corporate Affairs North Western, Region In the matter of the Companies Act, 2013, section 14 of Companies Act, 2013

> and rule 41 of the Companies (Incorporation) Rules, 2014

the matter of M/s. NOVEL CORPORATION **LIMITED** having its registered office at C 1175, PATDI CORPORATION LTD, R KT M NAWABWADI, RING ROAD, SURAT 395002, GUJARAT, INDIA,Applicant Notice is hereby given to the general public that the company intending to make ar application to the Central Governmen Regional Director under section 14 of the Companies Act, 2013 read with aforesaid rules and is desirous of converting into a private limited company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 20th October, 2020 to enable the company to give effect for such conversion.

Any person whose interest is likely to be affected by the proposed change/status of the company may deliver or cause to be elivered or send by registe objections supported by an affidavit stating the nature of his interest and grounds of opposition to the concerned Regiona Director North Western Region, Roc Bhavan, Opp Rupal Park Society, Behind Ankur Bus Stop, Naranpura, Ahmedabad 380013 (Gujarat), within fourteen days fron the date of publication of this notice with a copy to the applicant company at its egistered office at the address mentioned

For and on behalf of the Applican HARESHKUMAR KUNVARJIBHAI MANIA DIRECTOR DIN - 06370364 Registered Office- C-1175

Patdi Corporation Ltd, RKTM Nawabwadi, Ring Road Surat - 395002 Gujarat, India Date : 04.11.2020



Notice for Empanelment of Architects / Consultants, Civil / Interior, Electrical and Air-conditioning Contractors

Bank of Baroda invites application for empanelment of Architects / Consultant, Civil Contractors for Civil/Interior/Furnishing works, Electrical Contractors&Air-Conditioning Contractors for carrying various work for the Bank's branches / offices at Jurisdiction of Ahmedabad Zone for a period of three (3) years. For further information please log on to Bank's website www.bankofbaroda.com/tenders.asp. Interested firms may download the application form from Bank's website.

Last date of submission of forms 25.11.2020 by 3.00 pm. Bank of Baroda reserves the right to accept or reject any or all offers vithout assigning any reasons whatsoever thereof.

General Manager, Bank of Baroda, Ahmedabad Zone, 6th floor, Bank of Baroda Towers, Zonal office, Opp. Law Garden Ellisbridge, Ahmedabad 380 006



Axel Polymers Limited

CIN: L25200GJ1992PLC017678 Regd. Off: S. No. 309. Vil. Mokshi, Tal Savli, Dist Vadodara 391780 Telefax: +91 2667 244395. Website: www.axelindia.com Email: cs@axelindia.com

NOTICE

NOTICE is hereby given pursuant to Reg. 29 read with Reg. 47 of SEBI (LODR) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, 11.11.2020, at its registered office of the Company inter alia, to consider and approve the Unaudited Financial Results of the Company for the guarter and half year

This information is also available at the Website of the Company and Website of the Stock Exchange at www.bseindia.com.

Date: 03.11.2020

For Axel Polymers Limited CS Jigardan Gadhavi



BRIGADE PROPERTIES PRIVATE LIMITED

Corporate Identity Number (CIN): U70200KA2007PTC042824 Regd. Office: 29th Floor, World Trade Center, Brigade Gateway Campus 26/1. Dr. Raikumar Road, Malleswaram-Rajajinagar, Bengaluru 560 055. Ph: +91-80-4137 9200, 2221 7017-18.

Email: investors@brigadegroup.com Website: www.brigadecosmopolis.com

			Corresponding		
SI. No	Particulars	Current 6 months ended 30/09/2020 [Unaudited]	6 months ended in the previous year 30/09/2019 (Refer note 6) [Unaudited]	Year to Date figures for current period ended 30/09/2020 [Unaudited]	Previous year ended 31/03/2020 [Audited]
	Income				
	Revenue from operations	4,458	5,067	4,458	8,958
	Other income	94	119	94	163
	Total Income	4,552	5,186	4,552	9,121
	Expenses				
	Sub-contractor cost	700	910	700	2,237
	Cost of project materials consumed	248	-	248	57
	(Increase)/decrease in inventories of work-in-progress	(892)	2,135	(892)	1,494
	Employee benefits expense	25	32	25	59
	Depreciation and amortization expense	2,779	926	2,779	3,261
	Finance costs	2,677	2,462	2,677	4,673
	Other expenses	479	352	479	1,240
	Total Expenses	6,016	6,817	6,016	13,021
	Profit before tax (1-2)	(1,464)	(1,631)	(1,464)	(3,900)
	Tax expense				
	(i) Current tax	-	-	-	-
	(ii) Deferred tax charge/(credit)	(434)	(474)	(434)	(1,177)
	Total	(434)	(474)	(434)	(1,177)
	Profit for the year (3-4)	(1,030)	(1,157)	(1,030)	(2,723)
	Other comprehensive income (net of tax expenses)	-	-	-	-
	Total comprehensive income for the period (5+6)	(1,030)	(1,157)	(1,030)	(2,723)
	Eamings Per Share (EPS) - (in Rs.) (not annualised, face value Rs.10)				
	a) Basic				
	Class A equity shares		=	-	(*)
	Class B equity shares	(2.67)	(3.14)	(2.67)	(5.72)
	Class C equity shares	(2.72)	(2.91)	(2.72)	(8.55)
	b) Diluted (refer note 3)				
	Class A equity shares		÷	-	ж
	Class B equity shares	(2.67)	(3.14)	(2.67)	(5.72)
	Class C equity shares	(2.72)	(2.91)	(2.72)	(8.55)
	Paid-up equity share capital (face value per share - Rs. 10)	3,827	3,827	3,827	3,827
)	Paid-up debt capital (refer note 5)	30,379	33,510	30,379	38,213
	Other Equity	7, 44 5	10,040	7,445	8,474
2	Debenture redemption reserve	1,319	1,319	1,319	1,319
}	Debt equity ratio (refer note 4)	10.26	6.15	10.26	8.28
ı	Debt service coverage ratio (DSCR) (refer note 4)	0.05	0.34	0.05	0.17
5	Interest service coverage ratio (ISCR) (refer note 4)	0.45	0.34	0.45	0.17

- 1 Brigade Properties Private Limited ('the Company' or 'BPPL') had issued 490 A Series Non-Convertible Debentures ('NCD') of Rs.10,00,000 each on March 20, 2015, which were listed on BSE Limited ('BSE') on March 30, 2015.
- 2 The above unaudited financial results of the Company for the half-year ended September 30, 2020 have been reviewed by the Audit Committee and taken on record at the meeting of the Board of Directors of the Company held on November 03, 2020. The statutory auditors of the Company have carried out limited review of the above unaudited the financial results of the Company for the half-year ended
- 3 In accordance with the Indian Accounting Standard (IND AS) 33 Earnings Per Share, specified under Section 133 of the Companies Act 2013, read with relevant rules issued thereunder, there are certain class of securities which are anti dilutive and hence the impact of those securities has been ignored in the computation of diluted EPS.
- 4 (a) DSCR represents profit/loss from operations before finance cost (net of finance cost inventorised and charged to statement of profit and loss and net of finance cost capitalised), exceptional items and tax expenses/finance cost (gross of finance cost inventorised and charged to statement of profit and loss and net of finance cost capitalised) plus principal repayment of loan funds during the period. (b) ISCR represents profit/loss from operations before finance cost (net of finance cost inventorised and charged to statement of profit and loss and net of finance cost capitalised), exceptional items and tax expenses/finance cost (gross of finance cost inventorised and charged to statement of profit and loss and net of finance cost capitalised). (c) Debt equity ratio represents debt [long-term borrowings, short-term borrowings and current maturity of long-term borrowings and interest accrued (included in other financial liabilities)]/equity [equity share capital+other equity (including retained earnings and debenture
- 5 Paid up debt capital represents outstanding debt portion of redeemable preference shares and optionally convertible debentures, non convertible debentures and fully convertible debentures issued by the Company and interest outstanding thereon (excluding short term and long term bank borrowings).
- 6 The Scheme of Amalgamation between Brigade Properties Private Limited ('BPPL' or 'the Company') and its wholly-owned subsidiary Brookefields Real Estates and Projects Private Limited ('BREPPL'), and their respective shareholders and creditors (hereinafter referred to as "the Scheme") in terms of the provisions of Sections 230 to 233 of the Companies Act, 2013 for amalgamation of BREPPL with BPPL was approved by the Regional Director, Ministry of Corporate Affairs and Ministry of Commerce and Industry authorities on October 25, 2019 with appointed date of April 01, 2017. Pursuant to the Scheme, the Company had accounted for the merger during the year ended March 31, 2020, being a business combination involving entities under common control, using the pooling of interests method as prescribed in Ind AS 103 - Business Combinations. In this regard, the Company is in the process of ascertaining the requisite amount of stamp duty payable pursuant to the merger with the relevant regulatory authorities and the same will be accounted by the Company upon finalisation of the assessment and determination of the duty amount thereon by the regulatory authorities. This being a 'Business Combinations' under common control as described in Ind AS 103, the financial information in the financial results in respect of 6 months ended September 30, 2019 is restated as if the business combination had occurred from the beginning of the
- 7 The Company's management has considered the possible effects that may result from the COVID-19 pandemic on the carrying value of assets including investment property, capital work in progress, inventories including Transfer of Development Rights ('TDR') and receivables. In developing the assumptions relating to the possible future uncertainties in the economic conditions because of this pandemic, the Company, as at the date of approval of these financial statements has used internal and external sources of information to assess the expected future performance of the Company. The Company has performed sensitivity analysis on the assumptions used and based on the current estimates, the Company expects that the carrying amount of these assets, as reflected in the balance sheet as on September 30, 2020, are fully recoverable. The management has also estimated the future cash flows for the Company with the possible effects that may result from the COVID-19 pandemic and does not foresee any adverse impact on its realising its assets and in meeting its liabilities as and when they fall due. The actual impact of the COVID-19 pandemic may be different from that estimated as at the date of approval of these financial results.

Place: Bengaluru, India Date: November 3, 2020 For and on behalf of the Board of Directors of **Brigade Properties Private Limited** Director

પ્રથમ સત્રમાં રૂ.૧૪,૬७૯ કરોડનું ટર્નઓવર : કોટન, કપાસ, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક તેજી : બિનલોહ ધાતુઓ અને કૂડ તેલ પણ વધ્યા

કોમોડિટી વાયદાઓમાં કિંમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧७૪૫૩ સોદાઓમાં રૂ. ७०૯૯. ૩૫ કરોડનાં કામકાજ થયાં હતાં

મુંબઈ, તા. ૩ વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ કથુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સંગ્રમાં એમસીએક્સ વના કરત વર્ગના બમતાબક્સ પર ૨,૨૪,૪૦૯ સોદામાં રૂ.૧૪,૧૭૯.૭૧ કરોડનું ટર્નબોવર ોંધાર્થ હતં. કીમતી ધાતઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ સાવાયા વાચકાવા ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૨૬૭ની વૃદ્ધિ થઈ હતી. બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનજી સેગમેન્ટમાં કૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, કપાસ, સીપીઓ અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક તેજીનો

સોદાઓમાં રૂ. ૭૦૯૯. રૂપ કરોડનાં ના ભાવ રહ્યા હતા. કામકાજ થયાં હતાં. સાંનાના વાયદાઓમાં ચાંદી વાયદાઓમાં સોદી કરો કરે કરે કિલ્લાદીઠ કિસેમ્બર વાયદો જે આપરીઠ રૂ. ૧૧૯૮૦ ખુલી, ઊપરમાં રૂ. ૧૧૯૮૦ ખુલી, ઊપરમાં રૂ. ૧૧૯૮૦ અને નીચામાં રૂ. ૧૧૧૯૫૦ અને નીચામાં રૂ. ૧૧૧૯૫૦ અને નીચામાં રૂ. ૧૧૧૯૫૦ અને ના સાંચો રૂ. ૧૧૧૯૫૦ અને સાંચો પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૦૯૮૦ લીધો પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫૦૯૮૦ લીધો રૂ. ૧૫૦૯૮૦ લીધો રહ્યો હતો. રૂ. ૧૫૦૯૮૦ લીધો રહ્યો હતો. રૂ. ૧૫૦૯૮૦ લીધો રહ્યો હતો રૂ. ૧૫૦૯૦૦ લીધો રહ્યો હતો રૂ. ૧૫૯૦૦ લીધો રૂ. ૧૫૯૦૦ લીધો રહ્યો હતો રૂ. ૧૫૯૦૦ લીધો રહ્યો હતો રૂ. ૧૫૯૦૦ લીધો રહ્યો રૂ. ૧૫૯૦૦ લીધો રૂ. ૧૫૯૦૦ લીધો રહ્યો રૂ. ૧૫૯૦૦ લીધો રહ્યો રૂ. ૧૫૯૦૦ લીધો રૂ. ૧૫૯૦ લીધો રૂ. ૧૫૯૦૦ લીધો રૂ. ૧૫૯૦ લાધો રૂ. ૧ ગ્રામદીઠ રૂ.૪૧૦૪૨ અને ગોલ્ડ- રૂ.૬૨૨૯૨ બંધ રહ્યા હતા. પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ એનર્જ સેગ

કાય કામાહદાત્રના ૧૦૦૦ સોદાઓમાં કુલ રૂ.૨૬૭.૨૩ કરોડનાં કામકાજ થયાં હતાં કોટન નવેમ્બર વાવદો ગાંસડીઠી ર કરવામાં કારમાં નાંચાર પાસકા પાસકાઠા ર રૂ. રહે કરે કરા હતા. અને ચાંદી- રૂ. ૧૯૩૦ અને નીચામાં અને ચાંદી- રૂ. ૧૯૩૦ સુધી જઈ પ્રથમ ૨૮૪ વધીને સત્તનાં અંતે રૂ. ૧૬૦ વધીને હતા. રૂ. ૧૯૫૭૦ ના સ્તરે બંધ રહ્યો સંગમેન્ટમાં હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ સત્રનાં અંતે રૂ.૯ વધીને ૧ ગામદીઠ કુલ ૮૨૧ ૩૬ સોદાઓમાં ૧૦ કિલોદીઠ રૂ.૮૨૮.૫ ખૂલી,

જ્યારે મેંન્યા તેલ નવેમ્બર વાયદી ક્લોકીઠ ફ.૯૪૫.૫ ખૂલી, ધીપમાં ફ.૯૪૫.૫ ખૂલી, ધીપમાં ફ.૯૪૫.૫ સ્ત્રી, હતો ફ.૯૫૩.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્લિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૦૭ ખૂલી, ઉપરમાં રૂ.૧૧૨૧ અને નીચામાં ફ.૧૧૨૫ વર્ચા અંતે ફ.૧૮.૫૦ વાયીને રૂ.૧૧૧૮.૫ ના અતરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં સામકાજની દિશ્યો પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિચ વાયદાઓમાં મળીને ૧૮૧૫૮ સોદાઓમાં કુલ રૂ.૩૩૪૩.૯૦ કરોડ ની કીમતનાં ૨૫૫૮.૫૫૪

બબડાસા બેઠકની પેટાચુંટણી

અળડાસા બેઠકના પટાચૂટલા માટે વહેલી સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાંજે પ વાગ્યા સુધી પગ્યી વયુટકા મતદાન થયાના અહેવાલ છે. નખત્રાણામાં પાટીદાર વિસ્તારોમાંથી મતદારો

મતદાન કરવા ઉમટી પડ્યા છે.

ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના ગામ વિરાણી મોટીમાં મત આપ્યો છે.

આ સિવાય અપક્ષ ઉમેદવાર

કોમોડિટ વાવદાઓમાં રૂ.૫૪૫૧ થયા હતા, જ્યારે સોનું હતો. કૂ.૪૪૧૬ કરોડનો પૈયો થયા પ્રત્ય સત્રનાં એને ટ્ર.૪૩ ન ભાગ હતા, મળીને ૯૯.૬૯૫ સોદાઓમાં વાયદાઓમાં ૧૨.૬૭૨ ટન, કૂક અને નીચામાં રૂ.૪૪૫૫ સોદાઓમાં ફુલ ૧૧૭૪૫૩ રૂ.૧૩ વધીને બંધમાં રૂ.૫૪૦૪૫ એરલ્લા દ્વાર એમાં રૂ.૪૪૫૫ ત્યાર સોદાઓમાં વાયદાઓમાં ૧૨.૬૭૨ ટન, કૂક અને નીચામાં રૂ.૪૪૫૫ સોદાઓમાં રૂ.૪૪૫૫ કરોડ ની તેલમાં ૩૨૪૫ બેરલ્સ, કોટનમાં સત્રનાં એને ટ્ર.૪૩૫૫ પત્રની પ્રત્ય કેમ્સાનાં એને ટ્ર.૪૩૫૫ પત્રની પ્રત્ય કેમ્સાનાં એને ટ્ર.૪૩૫૫ પત્રની સોદાઓમાં ૧૨.૬૭૨ ટન, કૂક ૨૮૦૧૫ મોસદી, સીપીઓમાં ચાંદીના વાયદાઓમાં ચોંદી ભોલાઈ પ્રથમ સત્રનાં એને ટ્ર.૪૩૫૫ લાલા હતા. કેમ્સાનાં અને ટ્ર.૪૩૫૫ પત્રના સાથકો સોધાના પ્રાદાઓમાં અને કેમ્સાનાં સાથકો અને સાથકો અને સોદાઓમાં અને સાથકો સોધાના સાથકો સોધાના સોધાન ર કરો કરો છે. વરવા, કારોના રરપ સોદાઓમાં રૂ.૧૫.૯૯ કરોડનાં ૮૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૨૧૯૦ સોદાઓમાં રૂ.૨૪૭.૮૮ કરોડનાં ૨૯૮૧૦ ટન, મેન્યા તેલમાં ૧૭ સોદાઓમાં રૂ.૨.૩૭ કરોડનાં ૨૪.૮૪ ટન, કપાસમાં ૪૧ સોદાઓમાં રૂ.૧.૩૩ કરોડનાં ૨૪૦ ટનના વેપાર થયા હતા. ઓયન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં

હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સકિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ આપાન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસુવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ સાગસવાના નવાના કાંદ્રકુટ ૧૭ સામદીઠ રૂ. ૪૭૧.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૫૪૬ અને નીચામાં રૂ. ૪૬૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૧૪.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુંટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ

કો ન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૩૬ અને નીચામાં રૂ.૧૨૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે 3.9424.4 બંધ રહ્યો હતો રુવારે પુટ ઓપ્શન્સમાં રૂ.૧૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૪૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૮૫ અને નીચોમાં રૂ.૧૨૯૦ રહી પ્રથમ સત્રનાં અંતે

બોગસવોટિંગ કરવાના મુદ્દે ગઢડામાં ભાજપ- કચ્છની અબડાસા વિધાનસભા બેઠકની કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી પેટા ચૂંટણીમાં પ૭ ટકાથી વધુ મતદાન કોંગ્રેસ બેઠક બચાવશે કે ભાજપ જીત મેળવવામાં સફળ રહેશે તેનો મતદારો પર મદાર

ગઢડા,તા. 3 ગઢડા, વિધાનસભાની ચૂંટલીનું મતદાન બપોર સુધી શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું, પરંતુ મતદાન પૂર્ણ વેશામાં હતું તે સમયે ગઢડા જૂનન વિધાલયના ભુશ પર બોગસ વોટિંગની બાબતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોના કાઠલા પકડી જમીન પર પકડી ઢીકા પાટનો માર માર્યો હતો. મતદાન મથકમાં અને જાહેર માર્ગ પર પોલીસની હાજરીમાં મારીમારી થતાં જોનારાઓ દંગ રહી ગયા હતા. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો

હતો. ભોગ બનનાર અને કોંગ્રેસના

જ્ઞાહ્યાના મહત્વનાં સ્થળોનું રક્ષણ કરવા પહોંચી જાય. તેમણે વિયેનાવાસીઓને કહ્યું હતું કે મંગળારે તમારાં બાળકોને સ્કૂલમાં મોક્લતા નહીં. તમે પણ અનિવાર્ય કામ સિવાય ઘરમાં રહેજો.

શ્રમાસવાય પરમા રહજા. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટિયાની રાજધાની

વિયેનામાં થયેલા આ આતંકી હુમલાની નીંદા કરતા શોક વ્યક્ત

કર્યો છે. તેમલે કહ્યું કે ભારત વેચેનાની સાથે છે. અને તેમાલે

વિયેનાની સાથે છે. અને તેમણે પીડિત પરિવારો માટે સાંત્વના પણ વ્યક્ત કરી હતી. આ આતંકવાદી ઘટના એવા

આ આતકવાડા વટવા અવા સમયે થઈ જ્યારે ઑસ્ટ્રિયામાં કોરોના વાઈરસના સંક્રમણે કાબૂમાં કરવા માટે એક વખત ફરીથી

લોકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું હતું. લોકડાઉન લાગૂ થયાની એક

ઓસ્ટિયામાં...

પહેલાપાનનું અનુસંધાન



કાર્યકર મીડિયાને જણાવ્યું હતું કે, અમે આવ્યો તેણે મને કહ્યું કે તારાથી શાય તે અહીં બેઠા હતા ત્યારે એ શાખા એક કરી લે અને મારવા લાગ્યો હતો. મને ચોટરને લઈ ગયા હતા અને તે ચોટર સાતિ વિશે અપશબ્દો પણ કહ્યા હતા. વાટરન લઇ ગયા હતા અન ત વાટર ખોટો હતો. એ ભાઈને ખોટુ મનદાન કરાવવું હતું આથી મેં એ ભાઈને રોક્યો હતો. બુધાભાઈના કહેવાથી મે જાવા દીધા હતા. પછી એક રાખ્સ

રાત પહેલા લોકો આઝાદીનો આનંદ

માલી રહ્યાં હતા, ત્યારે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. જિલ્લા

આ ખેલને અંજીમ આપવાથી પહેલા ચીનના એન્જિનિયરોએ તિબેટમાં નદીઓની ધારાને બદલી દીધી જે નેપાળ અને ચીનની વચ્ચે

પ્રાકૃતિક સરહદનું કામ કરતી હતી. નેપાળી કોંગ્રેસના એક સાંસદ જીવન

બહાદુર શાહીએ કહ્યું કે, "ચીન કેમ નેષાળમાં આવવા ઇચ્છે છે, જ્યારે

તેની પાસે આપણા નાનકડા દેશ કરતા ૬૦ ગણી વધારે જમીન છે?" ના તો નેપાળ અને ના ચીને આ પ્રશ્ન પર કોઈ જવાબ આપ્યો છે.

<u>રાજ્યસાવામાં...</u> એટલે કોંગ્રેસની બેઠકો ઘટીને વર્શ જશે. ઉત્તર પ્રદેશથી ભાજપના જે સભ્યો જીત્યા એમાં કેન્દ્રીય પ્રધાન હરદીય સિંઘ પુરી, નીરજ શેખ, અરુણ સિંઘ, ચીતા

રાજ્યસભામાં...

હોસ્પિટલ ખસેડાયા છે. ઉમેદવાર મોહન સોલંકી અને કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ દોડી

શાક્ય, હરિદ્વાર દૂબે, વ્રજલાલ, બીએલ શર્મા અને સીમા દિવેદીનો

સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાં ભાજપના ઉમેદવાર નરેશ બંસલ

બિનહરીફ ચૂંટાયા હતા. દિલ્હીથી...

ગયા છે. જેમાં એક નગરપાલિકાનો સેવક કિશોરભાઈ જેબલિયા હતો અને અનિલળાઈને દીકરો જેનું નામ મને આવતું નથી. સામે મને માસ્વામાં ત્રણ ભાઈઓ હતા. આ લોકો સવારથી જ ખોડુ વોર્ટિંગ કરાવતા હતા, આ એમે કે નગરમાં કરિયાદ દાખલ કરી હતી કે ભાજપાલાખાનું એક ઈન્કિંગ કરી હતો. બોટું વોટિંગ ચાલે છે. આત્મારાથ પરમાર ખોટા વોટિંગ વગર જીતી શકે તેમ નથી. બોગસ વોટિંગ કરવામાં આવતું હોવાનો કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે. બોગસ વોટિંગ કરતા કોંગ્રેસના કાર્યકરે અટકાવતા ભાજપના

આ મિશન અંતર્ગત અત્યાર સુધી

૨૦ લાખથી વધુ ભારતીયોને પરત <u>લાવવામાં</u> આવી ચૂક્યાં છે. અત્યાર સુધીમાં ૧,૨૩,૦૯૭ લોકોના મોત કોરોના વાયરસના લીધે થયા છે. ૨૪ કલાકમાં પ૮,૩૨૩ દર્દી સાજા થતા અત્યાર

આ તમામ પેસેન્જર્સને કોરોના રિપોર્ટ નેગેટિવ જોયા બાદ જ પ્લેનમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય સુધીમાં કુલ ૭૬,૦૩,૧૨૧ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લો ૨૪ કલાકમાં ૧૦,૪૬,૨૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર એાવવામાં આવા હતા. હલ્લવનાવ છે કે, કોરોના મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. કોરોના પ્રકોપને પગલે ભારતે માર્ચ સુધીમાં કુલ ટેસ્ટની સંખ્યા ૧૧,૧૭,૮૯,૩૫૦૧ છે. એક્ટિવ કેસની સંખ્યા ૩૦ જુલાઈ બાદ સૌથી ઓછી નોંધાયી છે. દેશમાં કોરોનાનો કારાના પ્રકાવન વખત નારત નાવ મહિનાથી તમામ ઈન્ટરનેશનલ કલાઈટો પર રોક લગાવી દીધી હતી. જે બાદ મે મહિનામાં વંદે ભારત મિશનનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદેશમાં કસાયેલા બારતીયોને વતન પરત લાવવા માટે વિશેષ કલાઈટો શરૂ કરાઈ હતી. રિકવરી રેટ ૯૧.૯૬% છે. જ્યારે એક્ટિવ દર્દી દ.૫૪% છે. ડેથ રેટ ૧.૪૮% છે. તેમજ પોઝિટિવિટી રેટ ૩.૬૬% નોંધાવો છે.

Axel Polymers Limited

તો નખત્રાણામાં અન્ય વિસ્તારોમાં નિરુત્સાહ દેખાઈ રહ્યા છે.સવારે મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કાર્યકરોએ માર માર્યો હોવાનો આક્ષેપ ຮວດການໂວລາດທີ່ ເຮັ કર્યા છે. જેમાં કાંગ્રસના ઉમેદવાર ડો.શાંતિલાલ વિરાણીએ નખત્રાણામાં અને ભાજપના

> હનીફબાવા પઢીયારે નુંઘાતડ ગામમાં પોતાનો મત આપ્યો છે. તેવામાં કચ્છની અબડાસા બેઠકના નોકરીયાતોને મતદાન કરવા પગાર સાથે રજા આપવામાં આવી છે CHANGE OF NAME

I Have Changed My Name From SMITA SURYAKANT VADODARIA to GITABEN CHETANKUMAR MEHTA ADDRESS



મતદાન સવારે ૭ વાગે શરૂ કરી દેવાશે. પરંતુ, કોરોના શંકાસ્પદ માટે સાંજે પથી દ વાગ્યા સુધી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે સાંજે પ વાગે આવા છે. રાવવાર સાંજ પ વાળ પ્રચાર પડઘમ શાંત પડથા ત્યારે કોંગ્રેસ, ભાજપ ઉપરાંત અપક્ષે પણ અસરકારક અસ્તિત્વ સાબિત કર્યાના હેવાલ છે. હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસ પોતાની બેઠક બચાવવા સફળ થશે કે ભારતીય જનતા પાર્ટી ઈતિહાસ સ્થશે. કે પછી અપલને કારણે બંને પક્ષોન જીવ તાળવે ચોંટી જશે. જે

આજના મતદાન બાદ મતદાનની ટકાવારી જોઈને અંદાજ લગાવી Old Name Avdhut Tukaram Patanker New Name Avdhut Tukaram Patankar C/5 Amma Ashish Society, Nr. Telephone Exchange Harni Varasia Ring Road Vadodara. 390006

કોંગ્રેસના પોલિંગ એજન્ટ પર ભાજપના કાર્યકરોનો હુમલો ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટે યોજાઈ રહેલી પેટા ચૂંટણી માં કચ્છ જિલ્લાની અબહાસા બેઠકની પેટાચૂંટણી માટે બે મુખ્ય પક્ષ ક્રોસેક અને ભાજપ વચ્ચે તીવ સ્સાકસી જોવા મળી રહી છે. કચ્છે જિલ્લાની અબહાસ ચૂંટણીમાં મંત્રળવારના રોજ વેડહાર ગ્રામ ખાતે ક્રોગ્રેસના પોલિંગ એજન્ટ પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાની ઘટના બનવા પામી છે. ભાજપના બેથી ત્રણ કાર્યકરોએ કોંગ્રેસના પોલિંગ એજન્ટ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસે આ અંગે પોલીસમાં કરિયાદ પણ નોંધાવી છે.

શકાશે. સ્થાનિક સૂત્રો મુજબ વાલી વર્તનથી ખેલ પાડી દેવા કસર અબહામા નખાતામાં અને લખપન જોડી નથી અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના ગામડાઓમાં રાજકીય Panchmahal

ઉમેદવારના ટેકેદારોએ તો શામ. Regd. Office: GIOC Indu Kalos 389330, Dist. Par CIN: L2710+GJ1972PL Phone No: 02676-23 Fax No: 02676-23 દામ, દંડ, ભેદ પૈકી કર્યું પરિબળ કથાં ભાગ ભજવશે એ પ્રમાણે

TOWA SOKKI LIMITED NOTICE

NOTICE

7/1 મુંજાલ ઓટો ઇન્ડસ્ટ્રીઝ લીમીટક

નોટીસ

ા જાણકારી કંપની ની વેબસાઇટ મુંજાલ ઓટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે

તારીખ : - 03/૧૧/૨૦૨૦

Kavit industries Limited
CIN: L23100GJ199DPLC014992
gd. Off.: Tundov Anjesar Road, Village Tundav, Savil
Baroda, Gujarat, 391775. Tel: 0265-2362000;
Email: kavitindustrieslimited@gmail.com
Website: Www.kavitindustries.in

NOTICE OF THE BOARD MEETING

totice is hereby given pursuant to Regulation 29 read-legulation 47 of 5581 (LODR) Regulations, 2015, that deeting of the Board of Directors of Company will be hele uesday, 10th November, 2020, inter-alia, to consider handlited Financial Results for the quarter and half-inded 30th September, 2020 along with Limited Review Rep The said notice is also available at the investor Relation Sec of the Company's website at www.kavitindustries.in Corporate Announcement Section of Stock Exchange www.bseindia.com.

Date: 02/11/2020

Mikil Gohil Company Secretary A49993

INTEGRA	INTEGRA Engineering India Limited

Regd.Office:Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat Tel. No.+91 90999 18471, Fax No. +91-2676-220887, Email ID: info@integraengineeri Website: www.integraengineering.in, CIN – L29199GJ1981PLC028741

ment of Unaudited Consolidated Financial Results for the Quarter and six months ended 30th September 2020

nded	Quarter ended	
2020	30.09.2019	
,790.33	1,713.73	
255.51	289.76	
175.16	205.93	

SI.	Particulars	Quarter ended	Period ended	Quarter ended
No.		30.09.2020	30.09.2020	30.09.2019
1	Total Income from Operations	1,877.01	2,790.33	1,713.73
2	Net Profit / (Loss) for the period before Tax	296.98	255.51	289.76
3	Net Profit / (Loss) for the period after Tax	209.39	175.16	205.83
4	Total Comprehensive Income for the period	207.22	170.83	206.19
5	Equity Share Capital	342,45	342.45	342.45
6	Earning per share of ₹1 each			
	Basic	0.61	0.51	0.60
	Diluted	0.61	0.51	0.60
_	Notes			7

The above is an extract of the detailed format of Quarterly / Year ended financial results filed with the Stock Exchange unc Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year end financial results are available on the Company's website (www.integraengineering.in) and on stock exchange with

સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી

્રાંત સરકારનું સંયુધ્ધ સાહસ) જાહેર નિશિયાનાં, ધને ૧૦૦૦-૧૦૧૧ જાહેર નિશિયાનાં, ધને ૧૦૦૦-૧૦૧૧ આવી વુજરાત રજાર આદી પુરસ્તા અને ગરર વાલ્યસ લોકને માન્ય પારીયો લોક એકોની મોલોલ તથા કાલીને માન્યલ મારાતા અધિકૃત ઈપ્લરસ્તરો પારીયો નીર્સ જ્યારેલ કાલ્ય મોલે લાગો લીકાએને કાલ્યમાં નામ કેન્દ્ર ર રક્કાએ પોષ્ટ હોતાં / કોર્યો પોષ્ટ ની કાલ્યાઓ લાગો કોર્યો નામ કેન્દ્ર ર રક્કાએ પિત્ર ને, કિન્દ્રીય કોર્યોની, તાત્મારેક્લર, જીનવંદતની કરેરોએનો મોલાયાં આ લોક

છે. કૈરા કેન્દ્રર કોર્મ રજાના લિવસે સિવાય કવેડી સમય દરમાન તાજેતરના પાત કાર્ડ નંધર, જી.એસ.ટી. નંધરની પ્રપાલીત નાલ તેમજ લેન્દ્ર એસ.ટી. સ્ટી.સ.ટી. તેમજ કર્યાં નાંધપેલ રજાણેતાની નાલ જ પૂર્વ લેન્દ્ર આપવામાં ધ્યાલી. અપૂર્વ તેમજ માંગવામાં આવેલ તમામ પ્રમાણમાં વાગર ટેન્ટર ઓપવામાં ધ્યાલી. અપૂર્વ તેમજ માંગવામાં આવેલ તમામ પ્રમાણમાં વાગર ટેન્ટર હેમી ઉચ્ચ કરવામાં આવશે નહી.

કામનું લાય	(1) stuff vicegon 154. (2) Munch 1584 (3) 2-51 fl (2) digit	 (4) ક્રીચા ટેન્ડર કોર્મ આપવાની છેલાં તારીંબ અને સમય (3) ભરેલ ટેન્ડર પરાત લેવાની છેલાં તારીંબ અને સમય (3) ભરેલ ટેન્ડર ખોલવાની તારીંબ અને સમય
. 1		
યોલે મરોલી, મોખરા,	OO,50%,67,438 (4)	(ו) אמיזורסום זכסס אונו איל
	(4) \$1,3,430,00	(1) saist/cosa seco sau 9/0
કારવવામાં આવેલ પેતરેની જ્યોનમાં સિંપાઈ મુશ્ચિમ પુરી પાલ્યા અને તામુખરેલ પર સ્થાપાલિયા પંપ કેટ પુરા પાર્ટ કોલ્યાનમાં	(3) \$1.600.00 (3) 5.1 H-l 542	(ક) ૧૮૧૧/૧૦૧૦ ૧૧.૩૦ મહી છે. કેમ નવે છે

દાવવામાં આવશે નહી.
પ્રાથમાં આવશે નહી.
વિદાર કરિયાર કરે હોયર પુત્રના વસલાક ખેજ-લીધા વખતો વખતા વિપત્રે કરિયાર કરિયાર કરે હોયર કરે હતી.
વિદાર કરિયાર કરિયાર કરે હોય કરિયા કરે ન રહીકા દાવાને હાઠ સ્વયત્ર કરિયાર કરિયાર

(1) www.nprocure.com (2) www.statetenders.com

(માહિતી - બર્મદા - ૨૪૫ - ૨૦૨૦-૨૧) ન યો.બોપકામ(યુવ)ધિ.ને.ર કેવડીયા કોલોની.



NOTICE

to the state BOI A column of the column of t पञेशन नोडीस









(www.bseindia.com).

















